

## જૈન શાસનના પ્રભાવશાળી મંત્રો

૧. કોઈપણ શુભ મંત્ર ગણતાં પહેલાં, ગુરુ ભગવંતને પુછી, જણાવી સંમતિ લઈ ગણવો જોઈએ.
૨. શરૂઆત ૧ માળા પરમાત્મા સમક્ષ ૧ બાંધા પારાની નવકારવાળી ગણવી.
૩. શરૂઆત વહેલી સવારે, શુક્ર વસ્ત્રો, પૂર્વ કે ઉત્તર દિશા સામે બેસી કટાસણા ઉપર, નિયત સંખ્યાની માળા નક્કી કરી, સૂતરની માળા ઉપર ગણવાથી વિશેષ-વિશેષ લાભ થાય છે.
૪. શરૂઆત કરતાં પહેલાં દૃઢ સંકલ્પ કે આ જાપ પૂર્ણ કરીશ, ખાડો પાડ્યાં વિના કરીશ, ભાવથી ગણીશ, એકાગ્ર ચિત્તથી કરીશ અને સર્વના શ્રેય માટે કરીશ તો નક્કી કરેલ મંત્ર શીઘ્રતાથી ફળે છે.
૫. બ્રહ્મચર્ય વ્રત અવશ્ય પાળવું, કંદમૂળ અભક્ષ્ય ન ખાવું, શક્ય હોય તો આંબેલ કરવું જાપ દરમ્યાન, નહિંતર એકાશન-બિયાસણું કરવું, છેલ્લે રાત્રિભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો.  
- કોઈ પણ મંત્ર શક્તિશાળી હોય જ છે, ફળે જ છે. માત્ર શંકા-વ્હેમ કે ખંડિત થવાથી તે નિષ્ફળ બને છે. તેથી ધ્યાન દઈ, મન પરોવી, કેન્સરમાં ડોકટર પ્રત્યે શ્રદ્ધા રાખી દવા લઈએ તેમ સુદેવ-સુગુરુ પાસે શ્રદ્ધા રાખી જાપ કરવો.

શ્રી નમસ્કાર મહામંત્રના ગિંભત મંત્રો

દિવ્ય મંત્ર

(૧) ઐં હ્રીં નમો અરિહંતાણં, ઐં હ્રીં નમો સિદ્ધાણં, ઐં હ્રીં નમો આયરિયાણં,

ઐં હ્રીં નમો ઉવજઝાયાણં, ઐં હ્રીં નમો લો એ સવ્વસાહૂણં

વિધિ : આ પાંચ પદોનો રોજ ૧૦૮ વાર શાંત ચિત્તે જાપ કરવાથી ગેમ તેટલી મોટી આપત્તિ, ભય, ટેન્શન કે દુઃખો આવ્યા હોય તો તુરંત શાંત થાય છે. રસ્તો મળી આવે છે અને સુખના દિવસો ફરી પાછા આવે છે.

ચમત્કારીક મંત્ર

(૨) ઐં નમો અરિહંતાણં, ઐં નમો સિદ્ધાણં, ઐં નમો આયરિયાણં,

ઐં નમો ઉવજઝાયાણં, ઐં નમો લોએ સવ્વ સાહૂણં,

ઐં હ્રીં હ્રીં હ્રીં હ્રીં હ્રીં : સ્વાહા ા

ચમત્કાર કરે તેવો પ્રભાવશાળી મંત્ર છે. મનમાં જે જે ઈચ્છેલું હોય તે તો મળે જ છે. તે સિવાય તમારું હિત કે કલ્યાણ જેનાથી થવાનું હોય તે પણ મળી આવે છે. રોજ ૧૦૮ વાર પૂર્ણ શ્રદ્ધા અને શાંતિથી શુભ દિવસે ચાલુ કરી ગણવો.

૧૬ અક્ષરી વિદ્યામંત્ર

(૩) ‘અરિહન્ત સિદ્ધ આયરિય ઉવજઝાય સાહૂ ા ૨૦૦ વાર જાપ ઓછામાં ઓછો કરવો. રોજ ૨૧ દિન અખંડપણે ગણવો. લાભ થાય, કષ્ટ, રોગ, પીડા, ભય દૂર થાય.

ત્રિભૂવનસ્વામિની વિદ્યા

(૪) ઐં અર્હતે ઉત્પત ઉત્પત સ્વાહા ા શુભ દિવસથી, હૃદયકમળના અરિહંત ભગવંતને સ્થાપી, નિત્ય ૧૦૮ વાર જપવો. સર્વત્ર આદર, માન, યશઃ કીર્તિ અને પ્રભાવીપણું મળે.

નમસ્કાર મહામંત્રના ગુપ્ત ૪ મંત્રો

(૫) ૧. ઐં હ્રીં અર્હત ઉત્પત ઉત્પત સ્વાહા ા

શુભ દિને સારા મુહૂર્તે ત્રિકાળ દસ-દસ માળા ગણવાથી અખૂટ લક્ષ્મી મળે, દરિદ્રાતા શીઘ્ર ચાલી જાય છે.

૨. ઐં હ્રીં ચરે સુવરે અસિઆઉસાય નમઃ ા

આ મંત્ર સર્વ સિદ્ધિદાયક છે. મહાપ્રભાવક છે. રોજ ૧૦ માળા ગણવાથી મનવાંછિત મળે છે. ૨૧ દિન સુધી.

૩. ઐં હૈં હ્રીં શ્રીં ક્લીં બ્લૂં અહ્મં નમઃ ા ૨૧ હજારનો જાપ કરવો. પછી ત્રિકાળ ૧-૧ માળા ગણવાથી મનવાંછિત કાર્ય અચૂક સિદ્ધ થાય છે.

૪. ઐં તારે તારે વિરે, ઐં તારે વિરે વિરે હ્રીં ફટ સ્વાહા ા કોઈપણ રવિવારે સવારે સૂર્યોદય વખતે ભોજપત્ર પર અષ્ટગંધ શાહીથી લખવો. ૧૨૫૦૦, સાડા બાર હજારની જાપ કરી પછી રોજ ૧ માળા ગણવી અને સફેદ દોરાને લઈ ૧ ગાંઠ બાંધવી, બીજે દિને ૧ માળા ગણી રજી ગાંઠ બાંધવી એમ ૨૧ દિન ૧-૧ માળા ગણી ૧-૧ ગાંઠ બાંધી દોરો સાથે રાખવો. સર્વ કાર્ય અચૂક સિદ્ધ થાય. આ મંત્ર ૧૪ પૂર્વનો સાર છે. સત્યમ્ ા

૧૦૮ નવકાર સંપૂર્ણ હાથમાં નંદાવર્ત દ્વારા ગણવાથી મહાન લાભ થાય છે.

ઐં હ્રીં શ્રીં અહ્મં અ.સિ.આ.ઉ.સા. નમઃ ા ૧૦૮ વાર ગણવો. આ મંત્ર આનંદદાયક અને સર્વ કાર્યની સિદ્ધ કરવાવાળો છે.

જ્ઞાન પ્રાપ્તિ મંત્ર ઃ ઐં નમો અરિહંતાણં વદ વદ વાગ્વાહિની સ્વાહા ા

સ્વાસ્થ્યમંત્ર ઃ ઐં હ્રીં નમો લોએ સવ્વ સાહૂણં ૧ માળા

તનાવમુક્તિમંત્ર ઃ ઐં હ્રીં શ્રીં ભગવતે પાર્શ્વનાથાય હર હર સ્વાહા ા

ભયમુક્તિમંત્ર ઃ નમો અભય દયાણં (પ્રતિદિન ૧ માળા)

ક્રોધ આવેશ મુક્તિમંત્ર ઃ ઐં શાન્તે પ્રશાન્તે સર્વ ક્રોધો પશમની સ્વાહા ા

રિદ્ધિ-સિદ્ધિ વર્ધક મંત્ર ઃ ઐં હ્રીં શ્રીં ક્લીં બ્લૂં અર્હમ્ નમઃ ા (સૂર્યોદય સમયે ૧ માળા)

બ્રહ્મચર્ય વિકાસ મંત્ર ઃ દેવ દાનવ ગંધર્વા જઘ્ન રઘ્નસ કિન્નરા ા

બંભયારી નમંસંતિ દુક્કરં જેકરંતિ નમ્ ા ા

સુખ-શાંતિ મંત્ર ઃ ઐં હ્રીં શ્રીં અ.સિ.આ.ઉ.સા. સર્વ વિઘ્ન રોગો

પદ્મવ વિનાશાય મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા ા

ઐં ડગ્લી શ્રી અર્હમ્ નમઃ ા આ મૃત્યુંજય જાપ છે. સમાધિને સદગતિ આપે છે.

દરેક મંત્ર ગણતા પહેલાં આ વાક્ય બોલી મંત્ર ગણવાની શરૂઆત કરો. (શ્રી તિર્થંકર ગણધર પ્રસાદાત્ એષઃ યોગઃ ફલતુ)

ઉવસ્સગ્ગહરં સ્ત્રોત્ર - નમિઉણને ભક્તામર આ ત્રણે સ્ત્રોત્ર ગિભત મહાન લાભદાવી ચમત્કારી મંત્ર :-

હ્રીં શ્રીં અર્હમ્ નમિઉણ પાસ વિસહર વસહ જિણ- કુલિંગ ઐં હ્રીં શ્રીં અર્હમ્ નમઃ ા

શુભાશુભ જાણવાનો મંત્ર :- ઐં હ્રીં અર્હમ્ ક્ષવીં સ્વાહા ા

કોઈપણ કાર્યમાં લાભ-હાનિ, નફો-નુકસાન જાણવા માટે રાત્રે કપાળે ચંદનનું વિલેપન કરી તે સુકાઈ જાય ત્યારે ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરી અરિહંતં ભ.ને નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા ભૂમિ શયન ગરમ કામળી કે શેત્રંજી પર સૂઈ જવાથી સ્વપ્નમાં ધારેલા કામના ફળની ખબર પડશે.

શ્રી સરસ્વતી દેવી મહા મંત્ર :- ઐં હ્રીં કલીં બ્લીં શ્રીં હ.સ.ક.લ. હ્રીં અૈંં નમઃ ા

નવગ્રહના જાપ

૧. સૂર્ય મંત્ર :- ઐં હ્રીં રત્નાડુ સૂર્યાય સહસ્ર

કિરણાય નમો નમઃ સ્વાહા ા લાલ રંગની માળા ૬૦૦૦ જાપ

૨. ચંદ્ર મંત્ર :- ઐં રોહિણી પતયે ચંદ્રાય

ઐં હ્રીં હ્રાં દ્રીં ચંદ્રાય નમઃ સ્વાહા ા સફેદ રંગની માળા. ૧૦,૦૦૦ જાપ

૩. મંગળ મંત્ર :- ઐં નમો ભૂમિ પુત્રાય, ભૂ ભૂકુટિલ નેત્રાય

વક વદનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા ા લાલ માળા- ૭૦૦૦ જાપ.

૪. બુધ મંત્ર :- ઐં નમો બુધાય શ્રાં શ્રીં શ્રઃ દ્રઃ સ્વાહા ા લાલ રંગની માળાથી ૧૭,૦૦૦ જાપ.

૫. ગુરુ મંત્ર :- ઐં ગ્રાં ગ્રીં ગ્રૂં બૃહસ્પતયે સૂર પૂજયાય નમઃ ા પીળી અથવા સોનાની.

૧૬,૦૦૦ જાપ

૬. શુક્ર મંત્ર :- ઐં યઃ અમૃતાય અમૃત વર્ષણાય દૈત્ય ગુરવે નમઃ સ્વાહા ા

સફેદ સ્ફટિક અથવા રૂપાની માળા. ૨૦,૦૦૦ જાપ.

૭. શનિ મંત્ર :- ઐં શનેશ્વરાય ઐં કૌં હ્રીં કૌંડાય નમઃ સ્વાહા ા કાળી- અથવા અકલબેરની માળા.

૧૯૦૦૦ જાપ.

૮. રાહુ મંત્ર :- ઐં હ્રીં કાં શ્રીં વ્રઃ વ્રઃ વ્રઃ પિંગલ નેત્રાય કૃષ્ણ રૂપાય. રાહવે નમઃ સ્વાહા ા

(કાળી અથવા અકલબેરની માળા) ૧૮,૦૦૦ જાપ.

૯. કેતુ મંત્ર :- ઐં કાં કીં કૈં ટઃ ટઃ ટઃ છત્ર રૂપાય રાહુ તનવે કેતવે નમઃ ા

(કાળી અથવા અકલબેરની માળા) ૭,૦૦૦ જાપ.

૧૦. પદ્માવતી દેવીના મંત્ર ઃ ઐં હ્રીં એં ક્લીં હ્રીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ ઃ સવારના મંગલ પ્રભાતે સર્વતઃ શુદ્ધિ કરીને ત્રિકાળ ૧ માળા ગણો. પરિણામે ૮૧ દિવસ પછી લક્ષ્મીની વૃદ્ધી થતી જોઈ શકાશે.

૧૧. ઐં હ્રીં એં ક્લીં સર્વરોગ નિવારિણી શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ ઃ કોઈપણ રોગ શોક- આપત્તિમાંથી ઉગરવા માટે હંમેશા ૩ માળા ગણો.

૧૨. ઐં પદ્માવતિ પદ્મનેત્રે, લક્ષ્મી દાયિનિ, વાંછાપૂરણી ઋદ્ધિં સિદ્ધિં જયં જયં કુરુ કુરુ સ્વાહા ઃ આ મંત્રનો પૂર્વાભિમુખ રક્તાસને રક્ત માળાથી ૨૧ દિવસ રોજ ૧૦૦૦ જપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય. ધારેલા કામ પાર પડે. કોર્ટ કચેરીમાં જય મળે. ધંધા માટે ઘડેલી યોજના એક યા બીજા કારણે તૂટી જતી હોય તો પણ આ મંત્રનો ઉપર્યુક્ત વિધિથી જાપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણના પુષ્પોથી કરવું. જો બેંકમાંથી લોન મેળવવા પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ જાપ ઉપયોગી છે. દેવાદારની સ્થિતિ ટાળવા માટે આ જાપ કરવા જેવો છે.

૧૩. ઐં હ્રીં એં ક્લીં સર્વ સૌભાગ્ય દાયિનિ શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ ઃ આ મંત્રનો પૂર્વાભિમુખ રક્તાસને રક્ત માળાથી ૪૨ દિવસ ૧૦૦૦ જાપ કરવાથી કન્યા માટે ઈષ્ટ વર.ને વર માટે ઈષ્ટ કન્યાની વધુમાં વધુ ૬ માસમાં પ્રાપ્તિ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન. જાસુદ પૂષ્પથી કરવું. સ્ત્રી-પુરુષોના તૂટેલા સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે.

૧૪. ઐં ભ્રાં ભ્રીં ભૂં ભ્રઃ પદ્મે પદ્માવતિઃ ઃ આ મંત્રનું રટણ કરવાથી સંકટના સમયમાં સર્વ રીતે રક્ષણ મળે છે.

૧૫. ભક્તામર સ્તોત્રની ૬ઠ્ઠી ગાથાનો મંત્ર ઃ ઋદ્ધિ ઃ ઐં હ્રીં અર્હં નમો કુદ્ બુદ્ધિણં ઐં હ્રીં શ્રાં શ્રીં શ્રૃં શ્રઃ હું સં યઃ યઃ ઠઃ ઠઃ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદં કુરુ કુરુ સ્વાહા વિધિ ઃ છઠ્ઠી ગાથા ઋદ્ધિ તથા મંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિસ્મરણ થતું નથી વાણીથી શુદ્ધિ થાય છે. મૂર્ખતા દૂર થાય. જીભ તોતડાતી હોય તો છૂટી થાય. જો આ યંત્ર રૂપાના પતરા પર કોતરાવી તેનું પૂજન કરવામાં આવે તો છ માસમાં સરસ્વતી માતા વરદાન આપે છે.

ભ.ની ૧૧મી ગાથા ઃ ઋદ્ધિ ઃ ઐં હ્રીં અર્હં નમો પત્તેય બુદ્ધીણં

મંત્ર ઃ ઐં હ્રીં શ્રીં ક્લીં શ્રાં શ્રીં કુમતિ નિવારિણ્યૈ મહામાયાયૈ નમઃ સ્વાહા

વિધિ ઃ ૧૧મી ગાથા ઋદ્ધિ તથા મંત્ર ૨૧ દિવસ સુધી લાલમાળા વડે જપવાથી યંત્ર પાસે રાખવાથી વસ્તુ તથા ખોવાયેલ મનુષ્ય દાસ-દાસી પણ પાછા આવે છે. ચારે દિશામાં તેનો ૧૦૮ જાપ કરવાથી અને ઈન્દ્રધ્વજ શણગારી જલયાત્રા કરવામાં આવે એ વખતે ગીત-નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ અમારિ પડહ વગડાવી બલિ-બાકુલા ઉછાળી નગરના દેવી-

દેવતાને પૂજા અદ્વમની તપશ્ચર્યા કરી ૧૨,૦૦૦ સરસવના દાણા પર મંત્ર ગણી તેને ઉછાળવામાં આવે તો જરૂર વરસાદ આવે છે.

ભ.ની ૧૪મી ગાથા ઃ ઋદ્ધિ ઃ ઐં હ્રીં અર્હં નમો વિઉલ મઈણં

મંત્ર ઃ ઐં નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા

વિધિ ઃ ૧૪મી ગાથા ઋદ્ધિને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રને મસ્તક, ભૂજા કે હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. વળી પવિત્ર થઈ શ્વેત વસ્ત્રને શ્વેત માળાથી ધૂપ-દીપ પૂર્વક ત્રણ કાળ ૧૦૮ વાર જાપ કરી. ધી, ગૂગળ, કસ્તુરી, કેશર, કપૂર, સુખડ, રતાંજલી અગર શિલારસની ગુટિકા બનાવી હોમ કરવાથી તેમજ ત્રણેય કાળ સર. મૂંતિની સુગંધી દ્રવ્યોથી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે. લક્ષ્મીની વૃદ્ધિ થાય અને શત્રુનો ભય ટળે છે. હેતુ ઃ સ્મરણ શક્તિ તીવ્ર બને.

ભ.ની ૨૦મી ગાથા ઃ ઋદ્ધિ ઃ- ઐં હ્રીં અર્હં નમો ચારણાણં

મંત્ર ઃ ઐં શ્રાં શ્રીં શ્રૃં શ્રઃ રાત્રુભય નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા

વિધિ ઃ ૨૦મી ગાથા ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવાથી યંત્ર સ્ત્રીના કંઠે બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ સંપત્તિ સૌભાગ્ય બુદ્ધિને વિજય મળે છે. વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરા પર અષ્ટગંધાથી યંત્ર લખી તેની સ્થાપના કરી પૂર્વાભિમુખ બેસી રૂપાની નવકારવાળી ગણવી તેમજ સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર બનાવ તેના વડે યંત્રની પૂજા કરી ચડાવવો પછી- પંચામૃતથી તેનું પ્રક્ષાલન કરીને ને ન્હાવા રૂપાની વાટકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું આ પ્રકારે ઋણ ઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે. (હેતુ ઃ પુત્ર પ્રાપ્તિ થાય)

શ્રી માણિભદ્ર વીરના મંત્રો

ઐં અ.સિ.આ.ઉ.સા.નમઃ શ્રી માણિભદ્ર ા દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ્

ઐં નમો ભગવતે માણિભદ્રાય ક્ષેત્રપાલાય કૃષ્ણ રૂપાય ચતુર્ભુજાય જિન શાસન ભક્તાય, નવનાગ સહસ્ર બલાય, કિંનર કિંપુરુષ, ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત-પ્રેત પિશાય સર્વ શાકિની નિગ્રહં કુરુ કુરુ સ્વાહા મામ્ રક્ષ રક્ષ સ્વાહા ા

ઐં હ્રીં શ્રીં કલીં ક્ષીં માણિભદ્ર વીરાય હસ્તિ વાહનાય, ક્ષેત્રપાલાય વિંશતી સહસ્ર દેવ સહિતાય સર્વ જીવ હિતાય જલં દીપં અક્ષતં ફલં નૈવેદ્યં યજામહે સ્વાહા.

વિધિ ઃ આ મંત્રની સાધના રવિ, મંગળ કે ગુરુએ સુદ પક્ષમાં ૧લો રવિ કે મંગળ તેમજ સુદ પક્ષની ૫-૮-૧૪ તિથિ હોય. ત્યારે પ્રારંભ કરી એમ ૨૧ રવિ, મંગળ કે ગુરુ કરવા તે દિવસે ૨૧ માળા ગણવી અને વચ્ચેના દિવસોમાં ૧-૧ માળા ગણવી. તે દિવસે દેરાસરમાં સ્નાત્ર-પૂજા આંગી વગેરે કરવું કરાવવું.

આ પ્રમાણે જપને તપ કરનાર અનેક સંકટોમાંથી બચી જાય છે. રોગ-શોક, દુઃખ-દારિદ્ર તળે છે.  
ઈચ્છાઓ પૂર્ણ થાય છે.